

M/S SUNLIGHT EXTRUSION PRIVATE LIMITED (IN LIQUIDATION)

Liquidator Address: 330/348, Atlantis K-10, Sarabhai Main Road, Baroda- 390023,
Gujarat, cirp.sepl@ddip.in, jlusnb@gmail.com

E-Auction Sale Notice

Notice is hereby given to the public in general under the Insolvency and Bankruptcy Code, 2016 and Regulations there under, that the Process for Sale of M/s Sunlight Extrusion Private Limited- in liquidation (Corporate Debtor) **situated at 501 (I), 502 (I), 513 - 514, GIDC Estate, Waghodia, Vadodara - 391760, Gujarat, India** as a going concern (Option A) or to sale set of Assets collectively (Option B) or to sale class of Asset individually (Option C) will be sold by E-auction through the service provider **M/s E-procurement Technologies Limited** (Auction Tiger) via website <https://ncltauction.auctiontiger.net>.

Date and Time of Auction: 24.11.2021 Between 11:00 AM to 01:00 PM

| Option | Details of assets | Block | Reserve Price (Rs.) | Earnest Money Deposit (Rs.) |
|--------|-------------------------------------------------------------------------------------------------------------------------------------------|---------|---------------------|-----------------------------|
| A | Sale of Corporate Debtor as going concern along with all its assets including land and building, plant and machinery and financial assets | Block 1 | 6,90,50,000 | 69,05,000 |

OR**Date and Time of Auction: 24.11.2021 Between 02:00 PM to 04:00 PM**

(activated only if there is no bid received under Option A for sale as a going concern)

| Option | Details of assets | Block | Reserve Price (Rs.) | Earnest Money Deposit (Rs.) |
|--------|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|---------|---------------------|-----------------------------|
| B | Sale of set of assets collectively [including all land & building, plant & machinery and securities & financial assets (including receivables, licenses, and registrations)] | Block 1 | 6,90,50,000 | 69,05,000 |

OR

| C | Sale of set of individual assets | | | |
|---|--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|---------|-------------|-----------|
| | (i) Land & Building situated at 501 (I), 502 (I), 513 - 514, GIDC Estate, Waghodia, Vadodara - 391760, Gujarat, India (Land admeasuring 7361.88 sq. mtrs. and buildings admeasuring 2515.16 sq. mtrs.) | Block 2 | 3,37,00,000 | 33,70,000 |
| | (ii) Plant & Machinery situated at 501 (I), 502 (I), 513 - 514, GIDC Estate, Waghodia, Vadodara - 391760, Gujarat, India | Block 3 | 1,54,50,000 | 15,45,000 |
| | (iii) securities & financial assets (including receivables) | Block 4 | 1,99,00,000 | 19,90,000 |

Note:

- Option B and C will only be considered only if there is no bid received under Option A.
- The bidder/s having highest bid between Option B and total of option C (Block 2+ Block 3+Block 4) shall be the successful bidder/s. Option B will be given preference over Option C, if the bid amount under both option is equal.

| | |
|----------------------------------------|------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| Last Date for Submission of EMD | 22.11.2021 before 07:00 PM |
| Inspection Date & Time | On or before 20.11.2021 From 11:00 AM to 5:00 PM Contact person (Mr. Rushee Deopura: +91- 95740 85948, Mr. Hardik Surani: +91- 81600 94709) |

Interested bidders can submit the Bid documents, **Expression of Interest, Confidentiality and Non-disclosure undertaking** on or before **22.11.2021**.

The EMD (Refundable) shall be payable by interested bidder through NEFT/RTGS/Demand Draft on or before 22.11.2021 in account mentioned below.

Details of bank account are as follows:

| | |
|------------------|-------------------------------------------------------|
| Account Number | 5128154542 |
| Beneficiary Name | “Sunlight Extrusion Private Limited - in liquidation” |
| Bank Name | Central Bank of India |
| Branch | Nizampura Branch, Baroda, Gujarat |
| IFSC Code | CBIN0280487 |

For detailed terms and condition of E-auction sale, refer Sale Notice available on <https://ncltaucttiger.tiger.net> and on <https://www.ibbi.gov.in>. For any query regarding E-auction, contact Mr. Praveen Thevar at +91-9722778828, 079-61200531/559/594/554, E-mail ID: praveen.thevar@auctiontiger.net.

Date: 26.10.2021
Place: Vadodara

Sd/-
Abhishek Nagori
Liquidator of M/s Sunlight Extrusion Private Limited
IBBI Reg. No: IBBI/IPA-001/IP-P00020/2016-2017/10044

MSU કથિત ભરતી કોભાંડને મુદ્દે સત્તાધારી પક્ષના જ બે જૂથો વચ્ચે ઉભી તિરાડ

ખોટી માહિતી રજૂ કરનારા સામે ફોજદારી રાહે કાર્યવાહીનો ઠરાવ

MSUમાં સત્તાધારી જૂથે હરીફ જૂથને ભરતી કોભાંડને લગતી માહિતી ન આપી હરીફ જૂથના સભ્યો આજે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને રજૂઆત કરશે

। વડોદરા ।

કેટલાંક સેનેટ અને સિનિટીકેટ સભ્યો ભરતી કોભાંડના નામે ખોટી અને અધૂરી માહિતી સમાજ સમક્ષ રજૂ કરી રહ્યાં છે. આ પ્રકારે અધૂરી અને ખોટી માહિતી આપનારા સભ્યો સામે ફોજદારી રાહે કાર્યવાહી કરી તેમની સામે બદનશીનો દાવો માંડવો જોઈએ. કથિત ભરતી કોભાંડને મુદ્દે આજે મળેલી એમ એસ યુનિવર્સિટીની સિનિટીકેટની બેઠકમાં આ અંગેનો ઠરાવ કરાતો હશે કથિત ભરતી કોભાંડ વધુએ એક ગંભીર વળાંક લીધો છે. બીજા બાજુ સત્તાધારી જૂથને હંફાવવા મેંડાને પડેલ હરીફ જૂથના સભ્યો કથિત કોભાંડને મુદ્દે આવતીકાલે ગાંધીનગર ખાતે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીને પણ રજૂઆત કરવા જનાર છે. એમ એસ યુનિવર્સિટીમાં શૈક્ષણિક અને બીનશૈક્ષણિક કર્મચારીઓની ભરતીમાં કોભાંડ આચરણ હોવાના આક્ષેપ સાથે ત્રણ સિનિટીકેટ સભ્યો અને અન્ય કેટલાંક સેનેટ સભ્યોએ સવાનુમતે ઠરાવ કરી હરીફ જૂથ સામે વળતો ધા કરાવ્યો હતો. બીજા બાજુ આજે યુનિવર્સિટી હડ ઓફિસ ખાતે આયોજીત સિનિટીકેટની બેઠક વેળાં હરીફ જૂથના સભ્યો પણ તેમણે માંગેલી માહિતી મેળવવા પહોંચી ગયા હતા. જો કે તેઓ સત્તાધીશો પાસેથી માહિતી મેળવી શક્યા ન હતા.

સિનિટીકેટની બેઠક મળી હતી. બેઠકમાં વિગતવાર ચર્ચાને અંતે એમ એસ યુનિવર્સિટીમાં ભરતી કોભાંડના નામે ખોટી અને અધૂરી માહિતી આપનારા સભ્યો સામે ફોજદારી કાર્યવાહી કરવાની સાથે તેમની સામે યુનિવર્સિટી બદનશીન કરનાર સામે બદનશીનો દાવો માંડવા અંગેનો સવાનુમતે ઠરાવ કરી હરીફ જૂથ સામે વળતો ધા કરાવ્યો હતો. બીજા બાજુ આજે યુનિવર્સિટી હડ ઓફિસ ખાતે આયોજીત સિનિટીકેટની બેઠક વેળાં હરીફ જૂથના સભ્યો પણ તેમણે માંગેલી માહિતી મેળવવા પહોંચી ગયા હતા. જો કે તેઓ સત્તાધીશો પાસેથી માહિતી મેળવી શક્યા ન હતા.

બહુમતિના જોરે અમારો અવાજ દબાવી દેવાયો

આજે મળેલી સિનિટીકેટની બેઠકમાં માહિતી આપવાને બદલે અમારી સામે યુનિવર્સિટીને બદનશીન કરો છો, તેમ ખોટી માહિતી પૂરી પાડો છો તેવો વાહીયાર આક્ષેપ કર્યો હતો. સત્તાધીશોએ બીજાએ કથિત બેઠકનીમિત્તેના પ્રાધ્યાપકની ભરતીમાં નિયમોને સરેરાશ ભંગ કરી ગેરરિતી આચરી હતી. આ જગ્યા ઉપર પસંદગી પામેલા સંબંધિત ઉમેદવારે જોઈન વાચ નજીક ભણી દીધો છે. આ જ બાવલે છે કે ભરતીમાં કોભાંડ થયું છે. આગામી દિવસોમાં એમ નક્કર રજાનીતી ઘડી સત્તાધીશોને મજબૂત હાલત આપીશું.

— જો. દીલીપ કટારીયા

૨૦૧૫માં રૂ. ૧.૪૨ કરોડના રિપરિંગમાં પણ ભિલીભગતનો આરોપ વર્ષ ૨૦૧૫માં એમ એસ યુનિવર્સિટીના સત્તાધીશોએ બોર્ડર અને ગલ્ડે બંને હોસ્ટેલમાં રીપરિંગ કામ હાથ ઉપર લીધું હતું. સત્તાધીશોએ આ કામમા મીલીભગત કરી કોર્પેશન પ્રકારના ટેન્ડર સામોમીની કર્યા વિના જ બારોબાર અમદાવાદની એક સંસ્થાને સીધું જ કામ સોંપી દીધું હતું. રૂપિયા બે લાખ સુધીનો ખર્ચ સત્તાધીશો વિના ટેન્ડરે કરી શકે છે. પરંતુ તેથી વધુના કોર્પેશનના ખર્ચ માટે વાસ્તવમાં યુનિવર્સિટીએ ટેન્ડર પડકારી શકવી જોઈએ. આ બોર્ડર માટેનો સરકારી પરીણાસ હોવા છતાં સત્તાધીશોએ તેની ધરાવ અવગણના કરી ગેરરિતી આચરી હતી.

— જૈનમ જોષી, પૂર્વ વિદ્યાર્થી અગ્રણી

MSUની ભરતીમાં ગેરરિતિ થશે તે કોઈને નહીં છોડાય

આજે વડોદરા આવેલા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ સમક્ષ મોડિયાચે એમએસ યુનિવર્સિટીના ભરતી કોભાંડ સંદર્ભે સવાલ પૂછ્યો હતો. જે સંદર્ભે સીઆર પાટીલે ટૂંકાણમાં જવાબ આપતા કહ્યું હતું કે, એમએસ યુનિવર્સિટીમાં જે ભરતી થઈ તેમાં ગેરરિતિ આચરવામાં આવેલી હશે તો કોર્પેશન છોડવામાં નહીં આવે, અમે તમામની સામે પગલા ભરીશું. — સીઆર પાટીલ

‘મનકી બાત’માં કરજણની આરોગ્ય સેવિકાની સરાહના



તાજેતરમાં વડાપ્રધાનની ‘મનકી બાત’ કાર્યક્રમમાં પી.એમ. મોદીએ કરજણની આરોગ્ય સેવિકાની સરાહના કરી તેણીની કામગીરીને બીરદાવી પ્રોત્સાહીત કરી હતી.

૧૦ મહિનામાં ૨૪૦૦૦ નાગરિકોને રસી મુકનાર હેતલ મોચીની વડાપ્રધાને પ્રશંસા કરી

। વડોદરા ।

જિલ્લાના કરજણ અર્બન હેલ્થ સેન્ટરમાં આરોગ્ય સેવિકા તરીકે કરજ બજારના હેલ્થબેન મોચીએ છેલ્લા ૧૦ મહિનામાં ૨૪૦૦૦થી વધુ નાગરિકોને રસી મૂકી હતી. જે સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “મનકી બાત” કાર્યક્રમમાં હેતલબેનની તસવીર મુકી સરાહના કરી હતી. આ અંગે કરજણ તાલુકા આરોગ્ય અધિક્ષક ડી.પ્રશાંતસિંહે ઉલ્લેખ્યું હતું કે છેલ્લા ૧૦ મહિનાથી શરૂ કરાયેલા રસીકરણ દરમિયાન રોજ ૨૦૦ નાગરિકોને રસીનો ડોઝ આપી તેઓનું જીવન હેતલબેન મોચીએ સુરક્ષિત કર્યું હતું. જે સમયગાળા દરમિયાન ઉત્સવો અને

જાહેર રજાઓ પણ વિસરી હેતલબેન જનસેવામાં જોતરાયેલા રહ્યા હતા. પરિવારમાં સાસુ-સસરા બીમાર પડતા બાળકોની સારસંભાળ લેવાની કરજ પણ ચૂક્યા ન હતા. રસીકરણના બંને ડોઝ મળી હેતલબેન ૨૪૦૦૦ નાગરિકોને રસી મુકવાની ઉમદા કરજ બજારી હતી. તદુપરાંત નાગરિકોના મનમાં ઘર કરી ગયેલી ખોટી માન્યતાઓનું સમજાવટથી નિરાકરણ લાવી રસી લેવાનો ઉત્સાહ વધાર્યો હતો. જે સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “મનકી બાત” કાર્યક્રમમાં ઉલ્લેખ્યું હતું કે ૧૦૦ કરોડ કરોના રસીકરણની રાષ્ટ્રીય જવાબદારી સિધ્ધિમાં પાયાના કમંચોગીઓનો સિદ્ધાંતો છે.

જિલ્લામાં ૧૮,૨૭૭૮૫ નાગરિકોનું રસીકરણ

જિલ્લાના ૨૪૨ સબસેન્ટર, ૪૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સહિત ડબોઇ, પાદરા, કરજણ, સાવલી નગરપાલિકાના ૪ શહેરી આરોગ્ય કેન્દ્રો તેમજ ૧૦ સામુદાય આરોગ્ય કેન્દ્રોમાં રસીકરણ જારી છે. આજદિન સુધી ૧૦૮૬ કમંચોગીઓ અને

૧૪૦૦ આશાચક્ર બહેનોએ ફરડોડો રસીકરણમાં ૧૧,૦૩૩૮૬ અને સેકન્ડ ડોઝ રસીકરણમાં ૨,૨૪૪૦૮ મળી કુલ ૧૮,૨૭૭૮૫ નાગરિકોને રસીકરણ કર્યું છે. — ડૉ.સુરેન્દ્ર જૈન, ડી.ડી.એચ.ઓ.જિલ્લા પંચાયત

જૂના સાંધાના દર્દનો અસરદાર ઇલાજ

• ઘૂંટણનું દર્દ
• કમરનું દર્દ
• ખભાનું દર્દ
• કાંડાનું દર્દ
વગેરેમાં સહાયક

20% EXTRA
20% EXTRA

24x7 Helpline No. 7876977777 • Website: www.drorthooil.com • Available at all medical & general stores

મોદેમ જાવેદ કુરેશી, ૨૯ વર્ષ, તેમણે લખ્યું છે કે થોડા સમય પહેલા મારો અકસ્માત થયો હતો. જ્યારે મેં દવાઓ બંધ કરી તો ઘૂંટણમાં ઘણું દર્દ થવા લાગ્યું. હું બહુ જ પરેશાન હતો. પછી એક દિવસે મારા મિત્રએ આયુર્વેદિક ડૉ. ઓર્થો તૈલ અને કેપ્સુલનો ઉપયોગ કરવાની સલાહ આપી. મેં એનો ઉપયોગ કર્યો અને હવે દર્દ શું છે હું ભૂલી જ ગયો.

લક્ષ્મી બેનરજી, ઉંમર ૫૬ વર્ષ, છેલ્લાં ૨-૩ વર્ષથી કમરદર્દી દુખાવો રહેવા લાગ્યો હતો, ક્યાંક જવાના નામથી જ ડર લાગતો હતો. મેં સંપૂર્ણ આશા સાથે દિવસમાં ડૉ. ઓર્થો તૈલ સવાર-સાંચ ઘૂંટણો પર લગાવ્યું અને નિયમિત રૂપે કેપ્સુલ લેવાનું શરૂ કર્યું. માત્ર બે-ત્રણ હપ્તામાં જ ૭૦ ટકા આરામ થઈ ગયો.

વિનોદભાઈ, ઉંમર ૫૬ વર્ષ, પ્રાઈવેટ સર્વિસમાં છે અને ઓફિસ પ્લેચર હતા. છેલ્લા ૪-૫ વર્ષથી એમને જમણા ઘૂંટણ અને શરીરમાં દર્દની ફરિયાદ હતી. એમણે છાપમાં આયુર્વેદિક ડૉ. ઓર્થો તૈલ અને કેપ્સુલની જાહેરાત જોઈ અને તેનો ઉપયોગ કર્યો. તેઓ જણાવે છે કે તે ૪ મહિનામાં જ પહેલાથી ઘણું સાડું ફીલ કરી રહ્યા છે.

સંજુકુમાર, ઉંમર ૩૩ વર્ષ, લાયબ્રેરીમાં કામ કરે છે. તેમણે લખ્યું છે કે ૩-૪ વર્ષથી મારા ખભા અને ગરદનમાં દર્દ હતું. ઇલાજ પણ કરાવ્યો પરંતુ કોઈ ફેર ન પડ્યો. એક દિવસે મેં છાપમાં ડૉ. ઓર્થો તૈલ અને કેપ્સુલની જાહેરાત જોઈ. મેં સૂચના મુજબ ડૉ. ઓર્થો તૈલ મળ્યો છે. હું તમને વેસ્ટ કહેવા ઇચ્છું છું.

સંજુકુમાર, ઉંમર ૩૩ વર્ષ, લાયબ્રેરીમાં કામ કરે છે. તેમણે લખ્યું છે કે ૩-૪ વર્ષથી મારા ખભા અને ગરદનમાં દર્દ હતું. ઇલાજ પણ કરાવ્યો પરંતુ કોઈ ફેર ન પડ્યો. એક દિવસે મેં છાપમાં ડૉ. ઓર્થો તૈલ અને કેપ્સુલની જાહેરાત જોઈ. મેં સૂચના મુજબ ડૉ. ઓર્થો તૈલ મળ્યો છે. હું તમને વેસ્ટ કહેવા ઇચ્છું છું.

‘ડૉ. ઓર્થો’ની બધી પ્રોડક્ટ્સ ફક્ત ‘ડૉ. ઓર્થો’ નામથી જ બનાવવામાં આવે છે, મળતા-ભળતા નામ, પેકિંગ, સાંધાના શીશી, જાહેરાતથી સાવધાન. સર્વોત્તમ ડૉ. ઓર્થો જ ખરીદો.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ

તાજેતરમાં કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, વડોદરા દ્વારા સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ શિવ સાધના નૃત્ય સંગીત એકેડમિના કલાકારો દ્વારા રજૂ કરાયો હતો.

TENDER NOTICE
Ecocare Infrastructure Pvt. Ltd. owns and Project of Expansion of a Common Hazardous Waste Treatment, Storage and Disposal Facility (TSDF) At Village Ghaspur, Taluka Daskroi (Patel), District Surendranagar, Gujarat. Ecocare Infrastructures Pvt. Ltd. invites offers from Qualified & Experienced Environmental Project Management Consultant/Project of Expansion of a Common Hazardous Waste Treatment, Storage and Disposal Facility (TSDF). The scope of work includes Preparation of Engineering estimates, Drawings & layout, Specifications, Tender Preparation, Evaluation, Supervision during Implementation, Checking of work quality, billing & all other related work for the said project. Information about the project, Scope of work, Eligibility Criteria and Bid Document can be collected during on payment of fees of Rs. 25,000/- (Banker's Cheque/DD) from 26.10.2021 to 29.10.2021 between 11:00AM to 3:00PM. Following address & last date for submission of Tender is 02.11.2021 up to 3:00 PM.
Ecocare Infrastructures Pvt. Ltd.
501, Fifth Floor, Mansarovar Avenue, Opp. Tulishyam Flats, Bhimpipura, Navpada Vadd, Ahmedabad-390 013
Ph. +91-7434011011 & Email : ecocare@ecocareinfra.com

જાહેર નોટીસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે, મોજે ગામ : બળાઈવાળા, તા. હાલોલ, જી. પંચમહાલ મુકામે પાતા નં. ૪૦, રે. સ. નં. ૧૨/૨, જેનું સેક્શન ૦-૮૪-૬૮ હે.અર.ચો.મી., આકાર ૩. ૩.૩૭ પેસા વાળી ખેતીની જમીન તેના માલિક જયવંતસિંહ અમલાઈ વિગેરે નાઓની કબજા નોંધવવાની અગત્યની છે તે જમીન અમારા અસીલ અને વિષ્ણુકુમાર એ. શ્રીનાથ વેપારીના રાખવામાં છે. જેથી અમારી પાસે ટાઇટલ કલીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. જેથી સદરજૂ મિલકત અંગે કોઈનો કોર્પેશન જાતનો લાગ, ભાગ, હક્ક, હિત, સંબંધ, હિસ્સો કે કોઈ મંડળી કે કોઈ બેંકનો બોનો હોય તો તેઓએ દિન-૧૦ માં નીચે જણાવેલ સરનામે દસ્તાવેજ પુરાવા સહીત જાણ કરવી. જો મુદતમાં કોર્પેશન જાતનો વાંધો નહીં આવે તો ટાઇટલ કલીયરન્સ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તે પછી કોઈના કોર્પેશન જાતના વાંધા ચાલશે નહીં તેની જાહેર જનતાએ નોંધ લેવી. તા. ૨૬-૧૦-૨૦૨૧.

રહે. રવાણ, તા.વાઘોડીયા, જ.વડોદરા, રી.૨૩૩૮૩૯૪૬૭૭

રીતેશ આર. ભાતીયા (એડવોકેટ)

જાહેર નોટીસ
જાહેર જનતાને સદર નોટીસની જણાવવાનું કે, રજીસ્ટ્રેશન કીટરીક વડોદરા, સબ કીટરીક વડોદરા મોજે : સમા નાં રે.સ. નં. ૧૨/૨, જેનું સેક્શન ૦-૮૪-૬૮ હે.અર.ચો.મી., આકાર ૩. ૩.૩૭ પેસા વાળી ખેતીની જમીન તેના માલિક જયવંતસિંહ અમલાઈ વિગેરે નાઓની કબજા નોંધવવાની અગત્યની છે તે જમીન અમારા અસીલ અને વિષ્ણુકુમાર એ. શ્રીનાથ વેપારીના રાખવામાં છે. જેથી અમારી પાસે ટાઇટલ કલીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. જેથી સદરજૂ મિલકત અંગે કોઈનો કોર્પેશન જાતનો લાગ, ભાગ, હક્ક, હિત, સંબંધ, હિસ્સો કે કોઈ મંડળી કે કોઈ બેંકનો બોનો હોય તો તેઓએ દિન-૧૦ માં નીચે જણાવેલ સરનામે દસ્તાવેજ પુરાવા સહીત જાણ કરવી. જો મુદતમાં કોર્પેશન જાતનો વાંધો નહીં આવે તો ટાઇટલ કલીયરન્સ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તે પછી કોઈના કોર્પેશન જાતના વાંધા ચાલશે નહીં તેની જાહેર જનતાએ નોંધ લેવી. તા. ૨૬-૧૦-૨૦૨૧, વડોદરા.

આમાર અસીલની સુચના અને કરમાઈવાળી આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન કીટરીક વડોદરા, સબ કીટરીક વડોદરા મોજે : સમા નાં રે.સ. નં. ૧૨/૨, જેનું સેક્શન ૦-૮૪-૬૮ હે.અર.ચો.મી., આકાર ૩. ૩.૩૭ પેસા વાળી ખેતીની જમીન તેના માલિક જયવંતસિંહ અમલાઈ વિગેરે નાઓની કબજા નોંધવવાની અગત્યની છે તે જમીન અમારા અસીલ અને વિષ્ણુકુમાર એ. શ્રીનાથ વેપારીના રાખવામાં છે. જેથી અમારી પાસે ટાઇટલ કલીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. જેથી સદરજૂ મિલકત અંગે કોઈનો કોર્પેશન જાતનો લાગ, ભાગ, હક્ક, હિત, સંબંધ, હિસ્સો કે કોઈ મંડળી કે કોઈ બેંકનો બોનો હોય તો તેઓએ દિન-૧૦ માં નીચે જણાવેલ સરનામે દસ્તાવેજ પુરાવા સહીત જાણ કરવી. જો મુદતમાં કોર્પેશન જાતનો વાંધો નહીં આવે તો ટાઇટલ કલીયરન્સ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તે પછી કોઈના કોર્પેશન જાતના વાંધા ચાલશે નહીં તેની જાહેર જનતાએ નોંધ લેવી. તા. ૨૬-૧૦-૨૦૨૧, વડોદરા.

આમાર અસીલની સુચના અને કરમાઈવાળી આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન કીટરીક વડોદરા, સબ કીટરીક વડોદરા મોજે : સમા નાં રે.સ. નં. ૧૨/૨, જેનું સેક્શન ૦-૮૪-૬૮ હે.અર.ચો.મી., આકાર ૩. ૩.૩૭ પેસા વાળી ખેતીની જમીન તેના માલિક જયવંતસિંહ અમલાઈ વિગેરે નાઓની કબજા નોંધવવાની અગત્યની છે તે જમીન અમારા અસીલ અને વિષ્ણુકુમાર એ. શ્રીનાથ વેપારીના રાખવામાં છે. જેથી અમારી પાસે ટાઇટલ કલીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. જેથી સદરજૂ મિલકત અંગે કોઈનો કોર્પેશન જાતનો લાગ, ભાગ, હક્ક, હિત, સંબંધ, હિસ્સો કે કોઈ મંડળી કે કોઈ બેંકનો બોનો હોય તો તેઓએ દિન-૧૦ માં નીચે જણાવેલ સરનામે દસ્તાવેજ પુરાવા સહીત જાણ કરવી. જો મુદતમાં કોર્પેશન જાતનો વાંધો નહીં આવે તો ટાઇટલ કલીયરન્સ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તે પછી કોઈના કોર્પેશન જાતના વાંધા ચાલશે નહીં તેની જાહેર જનતાએ નોંધ લેવી. તા. ૨૬-૧૦-૨૦૨૧, વડોદરા.

આમાર અસીલની સુચના અને કરમાઈવાળી આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન કીટરીક વડોદરા, સબ કીટરીક વડોદરા મોજે : સમા નાં રે.સ. નં. ૧૨/૨, જેનું સેક્શન ૦-૮૪-૬૮ હે.અર.ચો.મી., આકાર ૩. ૩.૩૭ પેસા વાળી ખેતીની જમીન તેના માલિક જયવંતસિંહ અમલાઈ વિગેરે નાઓની કબજા નોંધવવાની અગત્યની છે તે જમીન અમારા અસીલ અને વિષ્ણુકુમાર એ. શ્રીનાથ વેપારીના રાખવામાં છે. જેથી અમારી પાસે ટાઇટલ કલીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. જેથી સદરજૂ મિલકત અંગે કોઈનો કોર્પેશન જાતનો લાગ, ભાગ, હક્ક, હિત, સંબંધ, હિસ્સો કે કોઈ મંડળી કે કોઈ બેંકનો બોનો હોય તો તેઓએ દિન-૧૦ માં નીચે જણાવેલ સરનામે દસ્તાવેજ પુરાવા સહીત જાણ કરવી. જો મુદતમાં કોર્પેશન જાતનો વાંધો નહીં આવે તો ટાઇટલ કલીયરન્સ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તે પછી કોઈના કોર્પેશન જાતના વાંધા ચાલશે નહીં તેની જાહેર જનતાએ નોંધ લેવી. તા. ૨૬-૧૦-૨૦૨૧, વડોદરા.

આમાર અસીલની સુચના અને કરમાઈવાળી આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન કીટરીક વડોદરા, સબ કીટરીક વડોદરા મોજે : સમા નાં રે.સ. નં. ૧૨/૨, જેનું સેક્શન ૦-૮૪-૬૮ હે.અર.ચો.મી., આકાર ૩. ૩.૩૭ પેસા વાળી ખેતીની જમીન તેના માલિક જયવંતસિંહ અમલાઈ વિગેરે નાઓની કબજા નોંધવવાની અગત્યની છે તે જમીન અમારા અસીલ અને વિષ્ણુકુમાર એ. શ્રીનાથ વેપારીના રાખવામાં છે. જેથી અમારી પાસે ટાઇટલ કલીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. જેથી સદરજૂ મિલકત અંગે કોઈનો કોર્પેશન જાતનો લાગ, ભાગ, હક્ક, હિત, સંબંધ, હિસ્સો કે કોઈ મંડળી કે કોઈ બેંકનો બોનો હોય તો તેઓએ દિન-૧૦ માં નીચે જણાવેલ સરનામે દસ્તાવેજ પુરાવા સહીત જાણ કરવી. જો મુદતમાં કોર્પેશન જાતનો વાંધો નહીં આવે તો ટાઇટલ કલીયરન્સ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તે પછી કોઈના કોર્પેશન જાતના વાંધા ચાલશે નહીં તેની જાહેર જનતાએ નોંધ લેવી. તા. ૨૬-૧૦-૨૦૨૧, વડોદરા.

આમાર અસીલની સુચના અને કરમાઈવાળી આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન કીટરીક વડોદરા, સબ કીટરીક વડોદરા મોજે : સમા નાં રે.સ. નં. ૧૨/૨, જેનું સેક્શન ૦-૮૪-૬૮ હે.અર.ચો.મી., આકાર ૩. ૩.૩૭ પેસા વાળી ખેતીની જમીન તેના માલિક જયવંતસિંહ અમલાઈ વિગેરે નાઓની કબજા નોંધવવાની અગત્યની છે તે જમીન અમારા અસીલ અને વિષ્ણુકુમાર એ. શ્રીનાથ વેપારીના રાખવામાં છે. જેથી અમારી પાસે ટાઇટલ કલીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. જેથી સદરજૂ મિલકત અંગે કોઈનો કોર્પેશન જાતનો લાગ, ભાગ, હક્ક, હિત, સંબંધ, હિસ્સો કે કોઈ મંડળી કે કોઈ બેંકનો બોનો હોય તો તેઓએ દિન-૧૦ માં નીચે જણાવેલ સરનામે દસ્તાવેજ પુરાવા સહીત જાણ કરવી. જો મુદતમાં કોર્પેશન જાતનો વાંધો નહીં આવે તો ટાઇટલ કલીયરન્સ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તે પછી કોઈના કોર્પેશન જાતના વાંધા ચાલશે નહીં તેની જાહેર જનતાએ નોંધ લેવી. તા. ૨૬-૧૦-૨૦૨૧, વડોદરા.

આમાર અસીલની સુચના અને કરમાઈવાળી આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન કીટરીક વડોદરા, સબ કીટરીક વડોદરા મોજે : સમા નાં રે.સ. નં. ૧૨/૨, જેનું સેક્શન ૦-૮૪-૬૮ હે.અર.ચો.મી., આકાર ૩. ૩.૩૭ પેસા વાળી ખેતીની જમીન તેના માલિક જયવંતસિંહ અમલાઈ વિગેરે નાઓની કબજા નોંધવવાની અગત્યની છે તે જમીન અમારા અસીલ અને વિષ્ણુકુમાર એ. શ્રીનાથ વેપારીના રાખવામાં છે. જેથી અમારી પાસે ટાઇટલ કલીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. જેથી સદરજૂ મિલકત અંગે કોઈનો કોર્પેશન જાતનો લાગ, ભાગ, હક્ક, હિત, સંબંધ, હિસ્સો કે કોઈ મંડળી કે કોઈ બેંકનો બોનો હોય તો તેઓએ દિન-૧૦ માં નીચે જણાવેલ સરનામે દસ્તાવેજ પુરાવા સહીત જાણ કરવી. જો મુદતમાં કોર્પેશન જાતનો વાંધો નહીં આવે તો ટાઇટલ કલીયરન્સ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તે પછી કોઈના કોર્પેશન જાતના વાંધા ચાલશે નહીં તેની જાહેર જનતાએ નોંધ લેવી. તા. ૨૬-૧૦-૨૦૨૧, વડોદરા.

આમાર અસીલની સુચના અને કરમાઈવાળી આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન કીટરીક વડોદરા, સબ કીટરીક વડોદરા મોજે : સમા નાં રે.સ. નં. ૧૨/૨, જેનું સેક્શન ૦-૮૪-૬૮ હે.અર.ચો.મી., આકાર ૩. ૩.૩૭ પેસા વાળી ખેતીની જમીન તેના માલિક જયવંતસિંહ અમલાઈ વિગેરે નાઓની કબજા નોંધવવાની અગત્યની છે તે જમીન અમારા અસીલ અને વિષ્ણુકુમાર એ. શ્રીનાથ વેપારીના રાખવામાં છે. જેથી અમારી પાસે ટાઇટલ કલીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. જેથી સદરજૂ મિલકત અંગે કોઈનો કોર્પેશન જાતનો લાગ, ભાગ, હક્ક, હિત, સંબંધ, હિસ્સો કે કોઈ મંડળી કે કોઈ બેંકનો બોનો હોય તો તેઓએ દિન-૧૦ માં નીચે જણાવેલ સરનામે દસ્તાવેજ પુરાવા સહીત જાણ કરવી. જો મુદતમાં કોર્પેશન જાતનો વાંધો નહીં આવે તો ટાઇટલ કલીયરન્સ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તે પછી કોઈના કોર્પેશન જાતના વાંધા ચાલશે નહીં તેની જાહેર જનતાએ નોંધ લેવી. તા. ૨૬-૧૦-૨૦૨૧, વડોદરા.

આમાર અસીલની સુચના અને કરમાઈવાળી આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન કીટરીક વડોદરા, સબ કીટરીક વડોદરા મોજે : સમા નાં રે.સ. નં. ૧૨/૨, જેનું સેક્શન ૦-૮૪-૬૮ હે.અર.ચો.મી., આકાર ૩. ૩.૩૭ પેસા વાળી ખેતીની જમીન તેના માલિક જયવંતસિંહ અમલાઈ વિગેરે નાઓની કબજા નોંધવવાની અગત્યની છે તે જમીન અમારા અસીલ અને વિષ્ણુકુમાર એ. શ્રીનાથ વેપારીના રાખવામાં છે. જેથી અમારી પાસે ટાઇટલ કલીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. જેથી સદરજૂ મિલકત અંગે કોઈનો કોર્પેશન જાતનો લાગ, ભાગ, હક્ક, હિત, સંબંધ, હિસ્સો કે કોઈ મંડળી કે કોઈ બેંકનો બોનો હોય તો તેઓએ દિન-૧૦ માં નીચે જણાવેલ સરનામે દસ્તાવેજ પુરાવા સહીત જાણ કરવી. જો મુદતમાં કોર્પેશન જાતનો વાંધો નહીં આવે તો ટાઇટલ કલીયરન્સ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તે પછી કોઈના કોર્પેશન જાતના વાંધા ચાલશે નહીં તેની જાહેર જનતાએ નોંધ લેવી. તા. ૨૬-૧૦-૨૦૨૧, વડોદરા.

આમાર અસીલની સુચના અને કરમાઈવાળી આથી જાહેર જનતાને જણાવવાનું